

## સીટી હોર્સિંગ ડ્રસ્ટ એવર સીરીઝ ઓફ વર્કશોપ્સ વીથ મ્યુઝિક-ઓન્ટેરિયો (આપણું શહેર મ્યુઝિક-ઓન્ટેરિયો સાથે પહેલી વાર શ્રેણીબદ્ધ વર્કશોપ્સનું આયોજન કરી રહ્યું છે)

**વર્ષ 2019 માં સંગીતમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક સ્થાનિક સંગીતકારો માટે ત્રણ વર્કશોપ્સ યોજાઈ રહ્યા છે.**

બ્રામ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 22, 2019) – સીટી ઓફ બ્રામ્પટન અને મ્યુઝિક-ઓન્ટેરિયો ગૌરવપૂર્વક રજૂ કરે છે *કમ્યુનિટીસ કનેક્ટ: બ્રામ્પટન*, સંગીતમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છુક સ્થાનિક સંગીતકારોને સહાયરૂપ થવા ત્રણ વર્કશોપ્સની શ્રેણી.

આ વર્કશોપ્સ સંગીતકારો માટે સંબંધિત વિષયો પર શ્રેણીબદ્ધ પેનલ ચર્ચા માટે 15 ઉપરાંત ઔદ્યોગિક વ્યવસાયિકોને સાથે લાવશે.

નીચેના વર્કશોપ્સ 2019 માં બ્રામ્પટન સિવિક સેન્ટરમાં (150 સેન્ટ્રલ પાર્ક ડ્રાઇવમાં) યોજવાના છે.

[મંગળવાર, માર્ચ 26 નાં રોજ સાંજે 6:30 વાગ્યે](#)

DIY (ડૂ ઈટ યોરસેલ્ફ) સંગીતકારથી ધંધાકીય સાહસિક સુધી: મ્યુઝિક બજમાં તમારી ટીમ બનાવવી

[મંગળવાર, એપ્રિલ 30 નાં રોજ સાંજે 6:30 વાગ્યે](#)

અધિવેશનો (કોન્ફરન્સીસ), તહેવારો અને નેટવર્કિંગ

[મંગળવાર, ઓક્ટોબર 1 નાં રોજ સાંજે 6:30 વાગ્યે](#)

સંગીત પ્રકાશન (મ્યુઝિક પબ્લિશિંગ), સમન્વય (સિંક) અને પરવાનો સંબંધિત (લાઇસન્સિંગ)

પોતાની કારકિર્દીના કોઈપણ તબક્કે સ્થાનિક સંગીતકારોને આ મફત પ્રસંગોમાં હાજર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

“બ્રામ્પટનનો રચનાત્મક સમુદાય પ્રતિભાઓથી તેજમય છે,” મેયર પેટ્રિક બ્રાઉને (Patrick Brown) કહ્યું. “મ્યુઝિક-ઓન્ટેરિયોની ભાગીદારીમાં, આ વર્કશોપ્સ આપણાં રચનાત્મક સમુદાયને સાથે લાવશે, અને તેઓના સંબંધોને ઉદ્યોગ નિષ્ણાતો અને એકબીજા સાથે પોતાના સંબંધોનું પાલન કરશે. આપણાં શહેરના સાંસ્કૃતિક માસ્ટર પ્લાનના લક્ષ્યાંકો પૈકી એક તરીકે, પ્રતિભા વિકાસ સ્થાનિક કળાકારોને ટેકો આપવામાં અત્યંત મહત્વનું છે.”

“મ્યુઝિક-ઓન્ટેરિયો સંગીત ઉદ્યમીઓ અને કળાકારો માટે આ સત્રો રજૂ કરવા સીટી ઓફ બ્રામ્પટન સાથે કામ કરવામાં રોમાંચિત છે,” મ્યુઝિક-ઓન્ટેરિયોના મેનેજર, એમી સ્ટાન્ટચેવાએ (Emy Stantcheva) કહ્યું. “વર્ષ 2017 માં ક્રિએટીવ એક્સચેન્જ પ્રો ઈવેન્ટ પોતાના રચનાત્મક વર્ગને આપણાં શહેરની સાચી ક્રિએટિવતાની ઝાંખી કરાવી, અને અમે બ્રામ્પટનના સંગીત સમુદાયને સેવા આપવા અવિરત સહયોગ માટે આશાવાદી છીએ. એક સંગીત ઉદ્યોગ મંડળ તરીકે, મ્યુઝિક-ઓન્ટેરિયોનો આદેશ સમગ્ર પાંતમાં સ્વતંત્ર સંગીત સમુદાય માટે વ્યવસાયિક વિકાસ, પ્રદર્શન, અને નેટવર્કિંગ માટેની તકો પૂરી પાડવાનો છે, પછી ભલે તેઓની ભૂગોળ, પ્રકાર, કે કારકિર્દીનો તબક્કો ગમે તે હોય, અને અમને આશા છે આ ભાગીદારી આ આબાદ સંગીત બજારમાં આપણી પહોંચની શરૂઆત માત્ર છે.”

આ વર્કશોપ્સ પર પૂરી વિગતો અહીં જોઈ શકાય છે: <https://music-ontario.ca/events>.

આપણાં શહેરના સાંસ્કૃતિક માસ્ટર પ્લાન વિશે વધુ અહીં વાંચો: <http://www.brampton.ca/culturemasterplan>.

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જ્યાં તે એક જોડાણ ધરાવતું શહેર અને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક:**

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)